

પ્રથમ વર્ષ એફ.વાય.બી.એ. એડમિશન નોટિસ(Revised)

ઓનલાઇન પ્રવેશ ફોર્મ તા. ૨૫/૦૬/૨૦૨૦ થી

૦૭/૦૭/૨૦૨૦ સાંજે ૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.

ઘોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) પછી B.A. અભ્યાસક્રમોમાં પ્રથમ સેમેસ્ટર માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ વ્યારા (અનુદાનિત) કોલેજમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

૧ . પ્રવેશ યોગ્યતા :- વિદ્યાર્થીઓએ ઘોરણ-૧૨ HSC ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

૨. અધર બોર્ડ તથા અધર સ્ટેટના વિદ્યાર્થીઓએ ઘોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાંથી પ્રોવિઝનલ એલિજબિલિટી સર્ટિફિકેટ(પીઇસી) કઢાવવાનું રહેશે.

૩. પાસ અગત્યનું : બી.એ. સેમ-૧માં ઘોરણ-૧૨ની માર્કશીટ ન આવી હોય તો ઇન્ટરનેટ પરથી મેળવેલ માર્કશીટના આધારે પ્રવેશ માટે કોલેજની વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. કોલેજ દ્વારા વિદ્યાર્થીનું અરજીપત્રક વેરિફિકેશન કરવામાં આવશે તથા વિદ્યાર્થીના મુખ્ય વિષય (અંગ્રેજી -ગુજરાતી-અર્થશાસ્ત્ર -સમાજશાસ્ત્ર)માંથી કોઈ એક વિષય નક્કી કરવામાં આવશે. અને ત્યારબાદ વિદ્યાર્થીને રજીસ્ટર મોબાઇલ કે ઇ-મેઇલ દ્વારા ઓનલાઇન ફી ભરવા

માટે મેસેજ મોકલવામાં આવશે. ફી ઓનલાઇન ભરવાની થશે તે જાણ માટે. (વિદ્યાર્થી ભાઈઓની ફી. રૂ. 2835 અને બહેનોની ફી. રૂ. 2235 છે.)

**** ખાસ નોંધ: આખરી પ્રવેશ લેતી વખતે ફરજિયાત ઓરીજનલ (મૂળ) માર્કશીટ જોડવાની રહેશે. (તમામ પ્રમાણપત્રો અને માર્કશીટની 10 ઝેરોક્ષ કઢાવી રાખવી)**

૪. એફ.વાય.બી.એ.ની પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઇન અરજી www.vyaracollege.in વેબસાઇટ પર કરવાની રહેશે. જેમાં પ્રથમ રજીસ્ટ્રેશન કરી આઇ.ડી પાસવર્ડ મેળવવાનો રહેશે. જેના માટે રજીસ્ટ્રેશન પ્રોસેસીંગ અને ફોર્મ ફી રૂ.150/- ડેબીટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / યુ.પી.આઇ / નેટ બેંકીંગ મોબાઇલ થી ઓનલાઇન ભરી અરજી કરવાની રહેશે. જે મોબાઇલ નંબર રજીસ્ટર થયેલો હોય તે મોબાઇલ નંબર ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન ફરજિયાતપણે સાથે રાખવો.

૫. રજીસ્ટ્રેશન ફોર્મમાં કોર્સ, સેમેસ્ટર,નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇ.ડી. ફરજિયાત લખવાનું રહેશે.

૬. રજીસ્ટ્રેશન દરમિયાન આપને મળેલ રજીસ્ટ્રેશન આઇ.ડી અને પાસવર્ડ યાદ રાખવા. અને અલગ કાગળ પર લખી અગત્યની ફાઇલમાં મૂકી રાખવા.

૭. કોલેજની વેબસાઇટ :- www.vyaracollege.in છે તેમાં ઓનલાઇન એડમીશન ટેબમાં પ્રવેશ ફોર્મ ભરવાની લિંક આપેલ છે. ફોર્મ સાથે જરૂરી માર્કશીટ અને અન્ય ડોક્યુમેન્ટ સ્કેન કરી સબમીટ

કરવું. (જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેનું લિસ્ટ વેબ સાઇટ પર છે).

નોંધ-૧ :- ફોર્મમાં રજીસ્ટર થયેલો મોબાઇલ અને ઇ-મેલ આઈ.ડી. ૩ વર્ષ સુધી બદલવા નહીં. (જે મોબાઇલ નંબર પર વોટ્સ અપ ચાલતું હોય તેવો જ નંબર આપવો.

નોંધ-૨ : એફ.બી.કોમમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું અને પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત આવ્યેથી યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પ્રવેશ યુનિવર્સિટી આપશે.

નોંધ -૩ : ઓનલાઇન પ્રવેશ માટે જરૂર પડે ઓફિસમાં સવારે ૧૧:૦૦ થી સાંજે ૪:૦૦ દરમિયાન ૦૨૬૨૬-૨૨૦૧૮૫ ઉપર સંપર્ક કરવો. ખાસ સંજોગોમાં સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ દરમિયાન ૭૮૭૪૭૦૦૪૦૬ ઉપર સંપર્ક કરવો.

પ્રથમ વર્ષ એફ.વાય.બી.એ. માં ચાલતા વિષયો

માનવ વિદ્યા પ્રવાહ				
૧.	ગુજરાતી અથવા અંગ્રેજી	ભાષા (ફરજિયાત)		
૨.	પર્યાવરણ	(ફરજિયાત)		
૩.	સંસ્કૃત	(ફરજિયાત)		
૪.	ગુજરાતી પેપર -૧-૨	મુખ્ય વિષય	પ. ગૌણ વિષય	હિન્દી અથવા સંસ્કૃત પેપર -૧-૨
	અથવા		અથવા	
૪.	અંગ્રેજી પેપર -૧-૨	મુખ્ય વિષય	પ. ગૌણ વિષય	હિન્દી અથવા સંસ્કૃત પેપર -૧-૨

સમાજવિદ્યા પ્રવાહ				
૧.	ગુજરાતી અથવા અંગ્રેજી	ભાષા (ફરજિયાત)		
૨.	પર્યાવરણ	(ફરજિયાત)		
૩.	સંસ્કૃત	(ફરજિયાત)		
૪.	સમાજશાસ્ત્ર પેપર -૧-૨	મુખ્ય વિષય	પ.	ગૌણ વિષય ઇતિહાસ અથવા

					મનોવિજ્ઞાન પેપર -૧-૨
	અથવા			અથવા	
૪.	અર્થશાસ્ત્ર પેપર -૧-૨	મુખ્ય વિષય	પ.	ગૌણ વિષય	ઇતિહાસ અથવા મનોવિજ્ઞાન પેપર -૧-૨

નોંધ : માનવવિદ્યા પ્રવાહ અથવા સમાજવિદ્યા પ્રવાહ આ બે માથી એક પ્રવાહમાં પ્રવેશ આપવામાં આવશે.